

**જન્મકુંડળીમાં બારમું સ્થાન શૈયાસુખનું છે.** જ્યારે જન્મકુંડળીના બારમા સ્થાનમાં બળવાન ગ્રહો હોય તો આવી વ્યક્તિઓ જાતીય સુખ માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

અલબત્ત જાતીયતા એટલે જીંટનું સૂચક સ્થાન છે આઠમું સ્થાન. જો આઠમા સ્થાનમાં સૂર્ય સિવાય સ્વગૃહી ગ્રહ હોય, બળવાન શનિ હોય કે પછી બળવાન શુક્ર હોય તો આવી વ્યક્તિઓ જાતીય બાબતે બેફામ બની જાય છે.

આ ઉપરાંત જો આવી વ્યક્તિનું લગ્ન શુદ્ધ રાશિનું હોય એટલે કે મિથુન, તુલા કે કુંભ રાશિનું હોય તો તેઓની નગ્નતા પ્રત્યેની સૂઝ અત્યંત ઘટી જાય છે અને એમાંયે મિથુન લગ્ન હોય તો તેવી વ્યક્તિઓ માટે મિથુનથી એટલે કે જાતીયતાથી વધુ શું હોઈ શકે?

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ પરાક્રમ કરવાનું અચૂક મન હોય છે પણ જે વ્યક્તિઓની કુંડળીમાં ત્રીજે રાહુ હોય તે વ્યક્તિઓ ક્યારેય સારાં પરાક્રમોમાં કે કહેવાતાં સહજ પરાક્રમોમાં ક્યારેય રુચિ લેતી નથી. આથી જ કિલર જીંટ સ્કેન્ડલમાં બહુ ઊંડો ઊતરી અને પોતાના હેતુઓ પાર પાડવા માટે કોઈનું શું થશે કે તેના કેવા પ્રત્યાઘાતો પડશે? તેની ચિંતા કર્યા વિના શાસકોને લપેટામાં લઈ અને પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે વેશ્યાગીરી કરવા સુધી આગળ વધી ગઈ.

આમ જન્મકુંડળીમાં સૂર્યનું બળ ખતમ થઈ જાય, મિથુન જેવા લગ્નો હોય, વૃષભ જેવી ચંદ્ર રાશિઓ હોય, શુક્ર-શનિનો પરિવર્તન યોગ હોય તો યોગ બળે આવી વ્યક્તિઓ અત્યંત હીણપતભર્યું કામ કરતાં પણ અચકાતી નથી.

જ્યારે જન્મકુંડળીનું લગ્ન મિથુન હોય તેવા કિસ્સાઓમાં તેવી કુંડળીઓમાં જાતીય બાબતે અચૂક વિચાર કરવો અને તેને મહત્ત્વ આપવું.

જ્યારે જ્યારે જન્મકુંડળીમાં વૃષભ રાશિનો ચંદ્ર હોય ત્યારે ત્યારે તેવા કિસ્સાઓમાં તેવી કુંડળીઓમાં જાતીય બાબતે વિચાર કરવો અને તેને મહત્ત્વ આપવું.

જ્યારે જ્યારે જન્મકુંડળીમાં આઠમા સ્થાનમાં શુક્ર હોય અને આ શુક્ર બળવાન થયેલો હોય તો પણ તેવી કુંડળીઓમાં જાતીય બાબતે વિચાર કરી કુંડળીના ક્ષણદેશ માટે આગળ વધવું જોઈએ.

જ્યારે જ્યારે જન્મકુંડળીમાં આઠમા કે બારમા સ્થાનમાં શનિ હોય અને આ શનિ યોગબળી હોય તો ભોગવિલાસ અને જાતીય બાબતોમાં તે શેતાનનું કામ કરી શકે.

જ્યારે સૂર્ય કે ગુરુ નિર્બળ બનેલા હોય તો આવી વ્યક્તિઓ માટે જાતીયતા એ રુચિનો વિષય હોય છે અને તેમનામાં જાતીયતાનો જવાળામુખી સુષુપ્ત અવસ્થામાં હોય છે, બસ તેને હવા મળવાની જરૂર છે.